

મે 14, 2018

સીટી ઓફ બ્રામ્પટનમાં વિક્ટોરિયા ડે 2018

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટન સીટી હોલ, વિક્ટોરિયા ડે માટે સોમવાર, મે 21 નાં રોજ બંધ રહેશે. આ દિવસે શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા સેવા સ્તરોમાં ઘટાડા સાથે કાર્યરત રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાયસન્સીસ મેળવવા, પરમીટ્સ મેળવવા અરજી કરી શકશે નહિ અથવા દંડ ભરી શકશે નહીં. ઓનલાઇન વિકલ્પો માટે કૃપા કરી વેબસાઇટ જુઓ www.brampton.ca.

સંખ્યાબંધ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેવાનું ચાલુ રહેશે, જેમાં સામેલ છે: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ (અગ્નિશમન અને કટોકટી સેવાઓ) અને બાય-લો એન્ફોર્સમેન્ટ. સીટી ઓફ બ્રામ્પટનની સેવામાં તમામ ફેરફારો અને સેવા બંધ રહેવાને લગતી વધુ માહિતી માટે, કૃપા કરી 311 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઇટ જુઓ, www.brampton.ca.

ટ્રાન્ઝિટ સેવાઓ

વિક્ટોરિયા ડે અઠવાડિક રજાઓ માટે બ્રામ્પટન ટ્રાન્ઝિટનું સમયપત્રક આ પ્રમાણે રહેશે:

- શુક્રવાર, મે 18: અઠવાડિક કામકાજના દિવસની નિયમિત સેવા
- શનિવાર, મે 19: શનિવારની નિયમિત સેવા
- રવિવાર, મે 20: રવિવાર/રજાના દિવસની સેવા
- સોમવાર, મે 21: રવિવાર/રજાના દિવસની સેવા

ટ્રાન્ઝિટ સ્ટોર્સ વિક્ટોરિયા ડે માટે મે 21 નાં રોજ બંધ રહેશે.

માર્ગ અને સમયપત્રક (રૂટ અને સ્કેડ્યુલ) માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કરો અથવા વેબસાઇટ www.bramptontransit.com જુઓ અને રિયલ-ટાઇમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા નેક્સ્ટ રાઇડ (Next Ride) નો ઉપયોગ કરો. સ્માર્ટફોન કે અન્ય મોબાઇલ ડિવાઇસ મારફતે વેબસાઇટ nextride.brampton.ca પર હાલની (ઓન ધ ગો) નેક્સ્ટ બસ માહિતી જુઓ.

મનોરંજન

મોટા ભાગની મનોરંજન સગવડો વિક્ટોરિયા ડે અઠવાડિક રજાઓ દરમિયાન ખુલ્લી રહે છે. કૃપા કરી તમારા સ્થાનિક મનોરંજન કેન્દ્રને ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઇટ www.brampton.ca જોઈને કાર્યક્રમનું સમયપત્રક પાકું કરો.

આતશબાજી સુરક્ષા

સીટી ઓફ બ્રામ્પટન દ્વારા આયોજીત આતશબાજી પ્રદર્શન વિક્ટોરિયા ડે પર કરવામાં આવતું નથી.

ગયા વર્ષે, ફટાકડાં વિક્રેતાઓને વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવે તે પહેલાં બ્રામ્પટને તેઓ માટે વાર્ષિક અનિવાર્ય અભ્યાસક્રમ શરૂ કર્યો. વિક્ટોરિયા ડે માટે બ્રામ્પટનમાં ફટાકડાં વેચવાનો પરવાનો ધરાવતા વિક્રેતાઓની યાદી શહેરની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવશે.

વિક્ટોરિયા ડે વર્ષમાં ચાર મંજૂર કરેલા દિવસોમાંથી એક છે જ્યારે ટૂંકા-અંતરના ફટાકડાઓ ફોડવાની છૂટ પાનગી મિલકતને આપવામાં આવે છે, જેમાં તેઓને પરમીટ લેવાની જરૂર પડતી નથી. ટૂંકા-અંતરના ફટાકડાઓ એ હોય છે જે ત્રણ મીટર (10 ફૂટ) કરતા ઓછું અંતર કાપતા હોય.

જ્યારે તે ફોડવામાં આવે (દા.ત. ફાઉન્ટેઈન્સ, વ્હીલ્સ, ગ્રાઉન્ડ સ્પિનર્સ, સ્પાર્કલર્સ). રોકેટ જેવા અન્ય તમામ ફટાકડાંની બ્રામ્પટનમાં મનાઈ ફરવામાં આવેલી છે. આ શહેર રહેવાસીઓને યાદ અપાવે છે કે ફટાકડાઓ ફોડવાની છૂટ સ્ટ્રીટ પર, સાઈડવોક્સ પર, શહેરના પાર્ક્સ કે મ્યુનિસિપલ અથવા સ્કૂલ મિલકતોમાં આપવામાં આવતી નથી.

તમારી મિલકતમાં ટૂંકા-અંતરના ફટાકડાઓને ઉપયોગમાં લેતી વખતે, તમારે આ [સુરક્ષા સાવચેતીઓ](#) અચૂક અનુસરવી રહી:

- તમારી પાસે ફટાકડાં હોલવવા પાણી ભરેલું પાત્ર અથવા પાણી ભરેલી હોઝ લાઈન અચૂક ઉપલબ્ધ હોવી રહી
- તમારે સ્પાર્કલર (તારામંડળ) સિવાય કોઈ ફટાકડા તમારા હાથમાં અચૂક ક્યારેય ફોડવા કે પકડી રાખવા ન જ જોઈએ
- સ્પાર્કલર્સનો ઉપયોગ કર્યા પછી, તેનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા પાડવા પાણીના પાત્રમાં રાખો
- તમામ ફટાકડાઓનો નિકાલ કરતા પહેલાં તેને પૂરેપૂરા ઠંડા થવા દો

બ્રામ્પટન પુસ્તકાલય

બ્રામ્પટનની તમામ પુસ્તકાલય શાખાઓ (સિવિક સેન્ટરમાં ચિંગકુસી, સીરિલ ક્લાર્ક, ફોર કોર્નર્સ, ગોર મેડોસ, માઉન્ટ પ્લેઝન્ટ વિલેજ, અને સાઉથ ફ્લેચર્સ) વિક્ટોરિયા ડે પર બંધ રહેશે.

વધુ માહિતી મેળવવા, 905.793.4636 અથવા 311 નંબર પર ફોન કોલ કરો, અથવા વેબસાઈટ જુઓ www.bramptonlibrary.ca

-30-

મીડિયા સંપર્ક (MEDIA CONTACT)

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca